



ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ
છહે માળ, ગિફ્ટ વન, માર્ગ-પ-સી, ઝોન-પ,
ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૩૫૫, ગુજરાત

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ સમક્ષ,
ગાંધીનગર

નીચેની બાબતો અંગે,

આયોગ દ્વારા જાહેર કરાયેલ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (રિન્યુબલ સંસાધનોમાંથી વીજળીની પ્રાપ્તિ)ના વિનિયમો-૨૦૧૪ સાથે વાંચતા ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (રિન્યુબલ સંસાધનોમાંથી વીજળીની પ્રાપ્તિ) વિનિયમો-૨૦૧૦ના પાલન માટે ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા સ્વયં અરજી નં. ૧૬૩૭/૨૦૧૬ શરૂ કરાઈ છે.

જાહેર નોટીસ :

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તથા ટોરેન્ટ પાવર લિમિટેડે RPO ના પાલન માટે અને ૨૦૧૪-૧૫ના નાણાકીય વર્ષની તેની ટકાવારીની સુધારણા માટે દાખલ કરેલ અરજી નં. ૧૬૦૪/૨૦૧૬ અને ૧૬૧૫/૨૦૧૬ આયોગને મળી છે. ઉક્ત અરજીમાં, આયોગે તેના તા. ૧૨-૦૧-૨૦૧૭ તથા ૪.૦૧.૨૦૧૭ના હુકમ અન્વયે સ્ટેક હોલ્ડરો પાસેથી અભિપ્રાય અને સૂચનો મંગાવવાનું નક્કી કર્યું હતું.

આયોગે ઉપર્યુક્ત હુકમ અને અરજી અન્વયે, રાજ્યના વિતરણ પરવાનેદારો દ્વારા RPO ના અમલીકરણની ખરાઈ કરવા સ્વયં કાર્યવાહી શરૂ કરવા અને વિતરણ પરવાનેદાર કસૂરના કેસમાં કોઈ હોય તો સંબંધિત કસૂરવાર વિતરણ પરવાનેદારો, જેમ કે એમ.યુ.પી.એલ, ટોરેન્ટ એનર્જી લીમિટેડ, કંડલા પોટ ટ્રસ્ટ, એસપેન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જુબિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, ગીફ્ટ પાવર કંપની લિમિટેડ તથા ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (નોડલ એજન્સી) સામે જોગવાઈઓ અનુસાર લેવાં જરૂરી પગલાં નક્કી કરવાનો નિર્ણય છે. જે મુજબ, આયોગ દ્વારા સ્વયં અરજી નં. ૧૬૩૭/૨૦૧૭, તૈયાર કરવામાં આવેલ છે. જે આયોગની વેબ સાઇટ (www.gercin.org) ઉપર મૂકવામાં આવેલ છે.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (કારોબારીનું સંચાલન) વિનિયમો ૨૦૦૪ અનુસાર, અહીં જાહેર કરવામાં આવે છે કે, ઉપરની સ્વયં કરાયેલી અરજી સંબંધમાં જેમને તેમના વાંધા/સૂચનો રજૂ કરવામાં રસ હોય તેવી વ્યક્તિઓ, તેઓ જેના પર આધાર રાખવા માગતા હોય તે એફિડેવિટથી યોગ્ય રીતે સમર્થિત દસ્તાવેજો સાથે તા.૨૮/૦૨/૨૦૧૭ પહેલાં સચિવશ્રી, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, છહે માળ, ગિફ્ટ વન, માર્ગ-પ-સી, ઝોન-પ, ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૦૩૫૫, ગુજરાતને રજૂ કરી શકશે અને તેઓને રૂબરૂમાં સાંભળે તેમ તેઓ ઇચ્છે કે કેમ તે પણ તેમાં દર્શાવે. સ્વયં કરાયેલી અરજી નં. ૧૬૩૭/૨૦૧૭ માટેની સુનાવણીની તારીખ ૦૪/૦૩/૨૦૧૭ના રોજ ૧૧.૩૦ વાગ્યે નક્કી કરી છે.

ઉપર્યુક્ત અરજીની ઇલેક્ટ્રોનિક નકલ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગની વેબ સાઇટ (www.gercin.org) પર ઉપલબ્ધ છે.

સહી/-
(રૂપવંત સિંહ, આઇ.એ.એસ)
સચિવ
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૦૨/૦૨/૨૦૧૭.